

Appendix-2

76

પરિશિષ્ટ-૨

(સાગરાના નયમોની પાઠ)

- ૧ અને ત્યાં સુધી વહેલા ઉઠવું.
- ૨ નિત્યકાર્યથી નિવૃત્ત થયા બાદ આગામી રાત્રે કરી રાખેલું
કામનું રિપ્પણ જોઈ જવું અને તદ્દનુસાર કાર્ય કરવા લક્ષ્યમાં રાખ્યું.
- ૩ અનતા સુધી કિર્પણ નવું બણાવા દરરોજ થતન કરવો.
- ૪ નવું બણાવામાં આવે તેની નોંધ કરવી.
- ૫ દિવસે ધારા શ્રમ વિના શૂવાની ટેવ રાખવી નહીં.
- ૬ રાત્રે રિપ્પણ કરવું કે બીજે દિવસે શું કામ છે ?
- ૭ હાન આપવું તે ખરેણાર નિર્ધારને જ આપવું, અપેગને આપવું,
અનાથને આપવું.
- ૮ ધર્મદાના કામમાં ઢીક કરવી નહીં. તેવું કિં પુણ્ય કરવાનું
ધાર્યું હોય તો તે બિલકુલ મોકુદ રાખવું નહીં.
- ૯ બરાયર ઓળખા વિના સહવાચ કરવો નહીં.
- ૧૦ સહાયારી સ્થાને વિશેષ પરિચય રાખવો.
- ૧૧ શીખેલું વારેવાર ચાદ કરી જવાની ટેવ રાખવી.
- ૧૨ ચારો શ્રદ્ધ બણાવામાં આવેતો તે તરત વર્ણવો.
- ૧૩ વર્ણવું શૈવીરીતે કે તેના મુદ્રા ચાદ રહે.
- ૧૪ ઉપરાયોટી વર્ણિ જવાથી લંગિન લાલ થતો નથી.
- ૧૫ અમૃક વિષયમાં આપણે અજ્ઞાત હોઈએ તો તેવા વિષયના Expert
પાણેથી તે જણી લઈ કામ ચલાવવું.
- ૧૬ ચોંચ વ્યાચામની ખાસ જરૂર છે.
- ૧૭ રાતે વહેલા જે સૂઈ વહેલા ઉઠે બીર,
અજ બુદ્ધિ બહુ ધન વધે સુખમાં રહે શરીર.
Early to bed, early to rise,
Makes a man healthy, wealthy & wise.
- ૧૮ વસ્ત્ર કિંભતી ન હોય તો ફિકર નહીં. પણ સ્વચ્છ જોઈએ.
- ૧૯ જમવામાં જેમ અને તેમ આત્મહૃત્યુવક ખાવું કે અવડાવવું નહીં.

- ૨૦ હમેશ ઈશ્વર પ્રાર્થના કરવી - નિયમ પ્રાર્થના કરવીજ.
- ૨૧ અગત્યનું કામ હોય તે બીજને ન સોંપતા જતે કરવું.
- ૨૨ સારું કામ જલ્દી કરવું - નહારું કરવું પડે તો હીલ કરવી.
- ૨૩ સારા કામોમણ પણ સંજનોની સલાહ લેવી.
- ૨૪ માશુસને મિત્ર હોવો જરૂર તો છે, માટે મિત્ર કરવો.
- ૨૫ મિત્ર છે તે ખંનિયાંન છે કે નહીં તેની આદ્રી કરવી.
- ૨૬ કોઈ સારું કામ કરતો હોય તો સેમણ બને રેટલી મદદ કરવી.
- ૨૭ કોઈપણ કામ મિત્રથી છાતું રાખવું નહીં, પણ તે મિત્ર પાકો ભરોસાપાત્ર હોવો જોઈશે.
- ૨૮ યત્ન કરવા છતો પણ નિષ્ફળતા મળો તો પુનર્યત્ન આપવો.
- ૨૯ દુર્ઘટસનથી બનતા સુધી સાદા દૂર રહેવું.
- ૩૦ વિચારો ઉચા રાખવા.
- ૩૧ ખાપણી એવકૂફી થઈ હોય તો તે જથું ત્યાં પ્રસ્ત્રિધ્ય કરવી નહીં.
- ૩૨ વિધા અને નીતિ બેની વારેવાર પ્રશ્નાં કરવી.
- ૩૩ કર્તિયં સત્તુ સન્નયં દૃઢા.
- ૩૪ કહેણી પ્રમાણે રહેણી રાખવા યત્ન કરવો.
- ૩૫ ધનવાન જોઈને સેહ કરવો નહીં પણ નીતિમાન જોઈને કરવો.
વધારે માન વિદોનને આપવું, રેણી ઉત્તરતું ધનવાનને આપવું.
- ૩૬ ગરીબ સિદ્ધતિમણી સારી સિદ્ધતિ થઈ હોય તો પૂર્વકાળ ભૂલી જવો નહીં.
- ૩૭ જમાનાને માન આપીને ચાલવું.
- ૩૮ બાળકોને સાફુવિધા ભણાવવી.
- ૩૯ બાળકોની બુદ્ધિ અને શક્તિ ઓળખી લેવી.
- ૪૦ પરિજનોના સ્વભાવને પોતે બણી છેવટે જેની જાણે જેમ ધરે તેમ વર્તવું.
- ૪૧ હમેશને માટે જેગ ઉપર આખૂષણો રાખવા નહીં.
- ૪૨ કોઈને પણ બોધ કરવો તો ધણો ગુપ્ત કરવો.
- ૪૩ અપરિચિત મનુષ્યને મળવું હોય તો ગુપ્ત મળવું.

- ૪૪ નકારૂ બોલવું નહીં.
- ૪૫ જે પ્રસ્તુતે જે ધર્તું હોય તે જરૂર જેટલું બોલવું.
- ૪૬ અહું જ મૌન ૨૧ણી મૂઢમાં અપીએ તેમ કરવું નહીં.
- ૪૭ પોતાનું દૃષ્ટાણ પોતે બાળવું અને સુધારવા થત્ન કરવો.
- ૪૮ પોતાની વણાણ પોતે ન કરવો.
- ૪૯ મિત્રની સાથે બજું પ્રેમથી વર્તવું - અનતા સુધી ચર્ચ સાથે.
- ૫૦ અનતા સુધી મિત્રની સાથે ક્લેશદેશનો વ્યવહાર રાખવો જ નહીં. તે છતાં જરૂર પ્રસ્તુતે રાખવો પડે તો મિત્રને આગત્ય પડે કોઈક આપવું. અને તે એ રીતે કે જે પાછું ન મળો તો પણ પોતાના જવને ક્લેશ થાય નહીં - મિત્ર પાણેથી કેવું પડે તો તુર્ત જ પાછું આપવું, ન આપી શકાય તેમ હોય તો કેતી વખતે જ કહેવું.
- ૫૧ મિત્રને બધી વાત કેવળ સત્ય જ કહેવી.
- ૫૨ પત્રાવ્યવહાર મોકાણે હાથે મિત્રોમાં રાખવો જે પ્રતિત્વાદ્યમાં સહાયભૂત છે.
- ૫૩ મિત્રની તેમજ કોઈની અની વાત અન્યને કરવી નહીં.
- ૫૪ ધર્મની બાળભર્તા વાદ કરવો નહીં. પણ પ્રસ્તુતોપાત સૈશય થાય તો તે સમર્થ જીની પાણેથી નિવારણ કરવું.
- ૫૫ કારણ વગર કોઈને ધેર જરૂર નહીં. : મિત્ર સૈશય :
- ૫૬ વેપાર અને જમણમાં શરમ રાખવી નહીં.
- ૫૭ અર્થનો હિસાય રાખવો.
- ૫૮ લૂગડલેતામાં ધણી પેસા અર્થવાં નહીં ગેમ સમજુ પુરુષોએ કહ્યું છે.
- ૫૯ કરકશરનો નિયમ ધણો જળવવો.
- ૬૦ વ્યય અને સૈશય એ બન્ને હુમેશા જોતાં રહેવું.
- ૬૧ પેસાની આપલેમાં હિસાય બોખ્ખો રાખવો.
- ૬૨ જેક જ માણસને મોટી રક્ષ ધીરવી નહીં.
- ૬૩ કરજ કરવું પડે તો હલકા માણસનું ન કરવું.
- ૬૪ રિપિયાની જરૂર પડે તો જણસ ગીરો મૂકવી નહીં પણ વેચી નાખવી.

- ૬૫ કરજ કરીને ધર કે ધરેણુ કરવું નહીં.
- ૬૬ ધણો માણસનું થોડું થોડું હેવું રાખવા કરતો એકનું ધણું હેવું
રાખવું એ ઠીક છે.
- ૬૭ અવરાવીને છુશી થવું પણ આઈને નહીં.
- ૬૮ સારું ચાહિત્ય વિચિવાનો અભ્યાસ રાખવો.
- ૬૯ જૂના કવિઓને લાઘાણો નકામો સમજવાં નહીં પણ તે
વિષે ધણો કિંમતી હોવાનો ભત રાખવો.
- ૭૦ પ્રશ્નગોપાત જૂનાં પથો વિથિને સમજવાં.
- ૭૧ ધધો કરવો, પણ ધધામો એટલા બધા માયાવશ ન થઈ જવું
કે પરમાત્માની પ્રાર્થના અને ગુણાનુકીર્તનની વિસ્તૃતિ થાય.
- ૭૨ ધડીએ ધડીએ અને પો પો મનમાં એ વિચાર વાળવો તે આ
બધું મિથ્યા છે - ગ્રાસ સત્ય છે. અને મારા દરેક કામ માટે
મારે જવાય હેવાનો છે.
- ૭૩ પરમેશ્વરની વારેવારે ધાસી રાખવી.
- ૭૪ આપણાથી કોઈ ભોડું પરિજન ન હોય તો અમુકને માની હેવું
અને તેની સલાહ હેવી. એ ખુદા નહીં હૈ તો ખુદા બંનાકે પૂજો ॥
- ૭૫ કોઈને પણ ખરો રસ્તો બતાવવો.
- ૭૬ દરરોજ રાંકે સૂતી વણ્ણે દિવસમાં કરેલો સારો અને નઠારો
કાર્યો ઉપર નિષ્ક્રિપત્વથો લિચાર કરવો.
- ૭૭ મિદ્રનું કુદ્દણ પોતાનું કુદ્દણ ગણવું.
- ૭૮ મિદ્રની ગેરહાજરીમાં મિદ્રનો કૌદુભ્યકોની હેવા કરવી.
- ૭૯ મરણ સમયે, ગૃહીર ભેદાળના પ્રસ્તુતિ અગર એવા કોઈ પ્રસ્તુતિ
પોતાનો સધળો પાપકર્યો તેમજ સત્કર્યો પોતાના ઈંદ્ર મિદ્રને
અગર તેની ગેરહાજરીમાં કોઈ સમર્થ મહાપુરુષને જહેર કરવો.
- ૮૦ દરેક રીતે લોકપ્રિય થવા ચાલ કરવો.
- ૮૧ શરીરદ્વારાપત્રિ સાધવવી.
- ૮૨ બનતા સુધી બિલકુલ જૂદું બોલવું નહીં અને નીતિશે જ ચાલવું
બીજાઓને પણ નીતિશે ચાલવામાં આપણો દાખલો મળો જેમ
વર્તવું.

- ૮૩ સ્વીનો વિલકુલ ભરોસો રાણવો નહીં.
- ૮૪ બહુધા સ્વીનોના સૈસર્માર્ચ થોડું આવવું.
- ૮૫ રપવતી સ્વીનોના પરિચયમાંજ આવવું નહીં. અને આવવું
પડે તો માત્ર ખપ જેટલીજ વાત કરવી.
- ૮૬ વ્યવહારમાં નિયેની કામો મુખ્ય ત્વે યોગ્ય રીતે થવો જોઈએ.
:૧: હૃવર પ્રાર્થના :૨: નીતિમય જવન :૩: પરિજનો
પ્રતિ ઉચ્ચિત વર્તન જેવું કે - ભિન્ન પ્રતિ, બ્રાતૃવર્ગ પ્રતિ,
માતા પ્રતિ, સૌતાનો પ્રતિ, :૪: પોતાનો ધધો
:૫: વિધાલિવૃદ્ધિ અર્થે શક્યાનુચાર પ્રયાસ
- ૮૭ પ્રત્યેક કાર્ય કરતી વખતે હેશ, કાલ ને સૌજોગો જોવા,
અને તપાસવું કે કાર્ય જાપ્તિ હેશકાળનું કુચતું છે કે નહીં ?
- ૮૮ યધપિ શુદ્ધા લોકું=વિરુદ્ધા।
ના કરણીય નાથરેણીય ॥ એ જમાનો હવે ધીમે
ધીમે બદ્લાતો જાણે. અને તેથી તેવા પડેલા રિવાજો દૂર
કરવા ચલ્યા કરવો. એ વાક્ય શીકરાચાર્યનું છે શેમ સમજ -
સત્ય માર્ગ જતો લોકો ને ભીડુતાને લિધે પાછા હઠવું નહીં
પણ સુધારા રૂપી સૂર્યનો ઉદ્ઘાટ કરવા ઉધુકત રહેવું.
- ૮૯ ૧૧ અભ્યાથી ભલું જોયું, અને જોયાથી ભલું જાણ્યું ॥
- ૯૦ કોઈપણ કાર્યની પ્રતિજ્ઞા કરી કરવી નહીં.
- ૯૧ અનાંદીઓ હિંદુચાર્યાણામ् ।
પ્રથમમું બુદ્ધિલક્ષણમ् ।
આદ્યાસ્ય નિન્ગાયનમ् ।
દિદ્તીય બુદ્ધિલક્ષણમ् । એ દ્યાનમાં રાખવું.